

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રેલ્વેને લગતા વિવિધ પ્રશ્નો અને તેના યોગ્ય નિરાકરણ માટે માનનીય સાંસદ સભ્યશ્રી મોહનભાઈ કુંડારીયા સમક્ષ રજુઆત કરવામાં આવેલ...

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ અને ડી.આર.યુ.સી.સી. મેમ્બરશ્રી પાર્થભાઈ ગણાત્રા દ્વારા રાજકોટ-સૌરાષ્ટ્રના મુસાફરો ખુબ જ મોટી સંખ્યામાં રાજકોટ રેલ્વે સ્ટેશન ખાતેથી મુસાફરી કરતા હોય છે ત્યારે તેઓને વધુ સારી રેલ્વે સુવિધા મળી રહે તેમજ રાજકોટ રેલ્વે સ્ટેશનથી વધારાની નવી ટ્રેનો શરૂ કરવા બાબતે માનનીય સાંસદ સભ્યશ્રી મોહનભાઈ કુંડારીયા સમક્ષ રજુઆત કરવામાં આવેલ.

(૧) જામનગર-બાન્દ્રા ટ્રેનનં. ૧૮૧૨૪ / ૧૮૧૨૩ હમસફર એક્સપ્રેસ હાલમાં અઠવાડિયામાં ત્રણ વખત ચાલુ છે, જેને કાયમી ધોરણે ચલાવવી.

(૨) ટ્રેનનં. ૧૮૫૬૫ / ૧૮૫૬૬ ઓખા-દેહરાદુન એક્સપ્રેસ અઠવાડિયામાં એક વખત જાય છે, આ ટ્રેન હરિદ્વાર મુસાફરી કરનાર માટે ખુબ જ અનુકૂળ અને ઉપયોગી હોવાને કારણે કમ સે કમ અઠવાડિયામાં ત્રણ વખત ચાલવી જોઈએ. તદ ઉપરાંત પોરબંદર થી દિલ્હી સરાઈ રોહિલા જતી ટ્રેનનં. ૧૮૨૬૩ ૧૪ ક્લાક સરાઈ રોહિલા પડી રહે છે તેને બદલે આ ટ્રેનને હરિદ્વાર સુધી લંબાવવામાં આવે તો મુસાફરોની સુવિધામાં ઘણો બધો વધારો થઈ શકે. આ સિવાય અમદાવાદ-હરિદ્વાર દિલ્હી મેઈલ કાલુપુર સ્ટેશન પર ૧૪ ક્લાકનો લાંબો હોલ્ટ ધરાવે છે જેને રાજકોટ સુધી લંબાવવી ખાસ જરૂરી છે.

(૩) તાજેતરમાં રાજકોટ રેલ્વે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર ૧ ઉપર ૩ એસ્કેલેટર પુરા પાડવામાં આવેલ છે. જે પૈકી બે એસ્કેલેટર અપ અને ડાઉન સુવિધા પુરી પાડે છે. પરંતુ પ્લેટફોર્મ નંબર ૨ ઉપર મુકવામાં આવેલ એસ્કેલેટર માત્ર અપ સાઈડની સુવિધા પુરી પાડે છે. આ સ્થળે ચોથું એસ્કેલેટર તાત્કાલીક મુકવાની ખાસ જરૂરીયાત છે.

(૪) રાજકોટ થી ચેન્નઈ જવા માટે ડાયરેક્ટ ટ્રેનની કોઈ સુવિધા ન હોવાને કારણે મુસાફરોને વાયા અમદાવાદ જવું અને આવવું પડે છે. જ્યારે ચેન્નઈ-અમદાવાદ ટ્રેનનં. ૧૨૬૫૬ અને ૧૨૬૫૫ નવજીવન એક્સપ્રેસ ને રાજકોટ સુધી લંબાવવામાં આવે તો આવા મુસાફરો સીધી ચેન્નઈની મુસાફરી કરી શકશે.

(૫) ટ્રેનનં. ૧૨૨૬૭ / ૧૨૨૬૮ મુંબઈ સેન્ટ્રલ-હાપા વચ્ચે દોડતી દુરન્ટો એક્સપ્રેસને બોરીવલી અથવા મલાડ સ્ટેશન ખાતે હોલ્ટ આપવાની ખાસ જરૂરીયાત છે.

(૬) ઓખા-જોધપુર વચ્ચે કોઈ ડાયરેક્ટ ટ્રેનની સુવિધા ન હોવાથી અઠવાડિક ટ્રેન ચાલુ કરવી ખુબ જ જરૂરી છે.

(૭) ઓખા-દિલ્હી વચ્ચે અઠવાડિક ટ્રેન ચાલુ કરવી.

(૮) ટ્રેનનં. ૨૨૮૩૭ / ૨૨૮૩૮ રાજકોટ રેવા ટ્રેન હાલ અઠવાડિયામાં એક વખત જાય છે. જેને અઠવાડિયામાં બે વખત શરૂ કરવી. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.